



SURAT DIAMOND BOURSE

Promoted by **SDB DIAMOND BOURSE** A Section 8 Company Registered Under The Companies Act, 2013

CIN NO. U74140GJ2014NPL081370 | GST NO..24AAVCS2416E1ZD

તા. 12/04/2019

પ્રતિ શ્રી,
સભાસદ,
સુરત ડાયમંડ બુર્સ
સુરત.

વિષય:- એક થી વધારે ઓફિસમાં આવતી દીવાલ નો નિકાલ કરવા બાબત.

માનનીય સભાસદ શ્રી,

આપણાં સૌના સહિયારા સહકારથી સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, અને તે સમયસર પૂર્ણ થાય તે માટે સુરત ડાયમંડ બુર્સની કમિટી અથાગ પ્રયત્ન કરી રહી છે.

તા.06/04/2019 ના રોજ પ્લાનિંગ કમિટીની મિટિંગમાં ચર્ચા થયા પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે કે જે મેમ્બરની એક થી વધારે ઓફિસ બાજુ બાજુમાં ફાળવવામાં આવી છે તે ઓફિસની વચ્ચે આવેલ દીવાલ ના રાખવા માંગતા હોય તો તે દીવાલ નો નિકાલ કરી શકે છે. જેથી બાંધકામ દરમ્યાન તે દીવાલ બનાવવામાં ના આવે.

તેથી જો આપ શ્રી ઓફિસ વચ્ચે આવતી દીવાલ નો નિકાલ કરવા માંગતા હોય તો સુરત ડાયમંડ બુર્સની ઓફિસ પરથી અથવા વેબ સાઇટ પરથી ફોર્મ અને નિયમોની માહિતી મેળવી તા. **13/04/2019 થી 22/04/2019** સુધીમાં સુરત ડાયમંડ બુર્સની સાઇટ ઓફિસ 177/પી, ડ્રીમ સીટી, ખજોદ, સુરત પર સવારે 9:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી માં જાણ કરવાની રહેશે.

આપનો વિશ્વાસુ,

પ્લાનિંગ કમિટી – એસ.ડી.બી. ડાયમંડ બુર્સ.

અરજી ફોર્મ

તા. / /
હું/અમે _____ બે ઓફિસ વચ્ચે આવતી દીવાલ નો
નિકાલ કરવા માંગીએ છીએ. જેની વિગત નીચે પ્રમાણે છે.

મેમ્બરશીપ નંબર :- _____	કંપની /વ્યક્તિનું નામ:-
કોન્ટેક્ટ નંબર:-	
જે ઓફિસમાંથી દીવાલ નિકાલ કરવાની હોય તેની વિગત :	

ઓફિસમાં આવતી દીવાલનો નિકાલ કરવા માટે પ્લાનીંગ કમિટી દ્વારા જે નિમયો નક્કી થયા છે તે નીચે પ્રમાણે છે, જે અમોને મંજૂર છે.

નિયમો:

1. અરજી ફોર્મ તા. 13/04/2019 થી 22/04/2019 સુધીમાં સુરત ડાયમંડ બુર્સની સાઈટ ઓફિસ 177/પી , ડ્રીમ સીટી, ખજોદ, સુરત પર સવારે 9:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી માં જમા કરાવવાનું રહેશે.
2. જો આપશ્રી દીવાલ ના રાખવા માંગતા હોય તો સાઈટ ઓફિસ પર રૂબરૂ આવી પ્લાનમાં ચકાસી જવું.
3. આપની ઓફિસની મધ્યમાં જે દીવાલ આવે છે તે દીવાલનો જ નિકાલ કરી આપવામાં આવશે.
4. ફક્ત ઓફિસની મધ્યમાં આવતી દીવાલનો જ નિકાલ કરી આપવામાં આવેશે તે સિવાય કોલમ, કોમન શાફ્ટ કે કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બરમાં કોઈપણ ફેરફાર થઈ શકશે નહીં.
5. નિકાલ કરવામાં આવેલ દીવાલના બદલામાં ઓફિસમાં નવી કોઈ દીવાલ બનાવી આપવામાં આવશે નહીં.
6. જો કોઈ ભાગીદારી પેઢી/કંપની/LLP મેમ્બર હોય તો તેઓ બધા જ ભાગીદારની સહી-સિક્કા સાથે નો ઓથોરાઇઝ્ડ/બોર્ડ રિજોલ્યુશન લેટર સાથે જોડવાનો રહેશે.
7. જો કોઈ મેમ્બર દીવાલ નિકાલ કરવા માટે અગાઉ કોઈ અરજી આપી હોય તો પણ ફરીથી અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે.
8. હાલ દરેક ઓફિસ દીઠ ઇલેક્ટ્રિકલ મીટર અને સર્વિસીસ પ્લાન કરવામાં આવેલ છે. દીવાલ હટાવ્યા બાદ ઇલેક્ટ્રિકલ મીટર માટે જરૂરી પાર્ટશન મેમ્બરે પોતાના ખર્ચે અને જવાબદારીએ કરવાનું રહેશે.
9. એકવાર દીવાલમાં ફેરફાર થયા પછી પાછળથી બીજીવાર કોઈ ફેરફાર કરી આપવામાં આવશે નહીં.
10. આ અંગે નો અંતિમ નિર્ણય કમિટીનો રહેશે. જે અમોને માન્ય રહેશે.

આપનો વિશ્વાસુ,